

ED makes third arrest in West Bengal coal mining case

New Delhi, May 28 (ANS) The Enforcement Directorate (ED) on Friday said it has arrested a person in connection with a money laundering case pertaining to illegal coal mining in West Bengal.

This is the third arrest in the case. Earlier, two police officials of West Bengal Police department were placed under arrest and a chargesheet was filed against them in 2021.

A senior ED official said the accused Gupurda Maji was placed under arrest as per section 19(1) of the Prevention of Money Laundering Act.

The ED produced Maji at Rouse Avenue Court on Friday. The court sent him to seven-day custodial remand. He is one of the partners of Anup Majee, the kingpin of illegal coal mining business activities in West Bengal. Maji has received more than Rs 66 crore from the proceeds of crime generated through illegal coal mining business from Majee and his associates. Further, he had provided Rs 26 crore in cash to a Kolkata-based chartered accountant for arranging shell companies for the purpose of illegal coal mining entries, said the ED official.

The official added that Maji had acquired 13 shell companies with the help of the above Kolkata-based CA. The net worth of these 13 shell companies is more than Rs 28 crore but he acquired these companies at a cost of only Rs 88 lakh on paper to respective shareholders, thereby managing to bring illegally generated cash in financial system.

Earlier, two accused persons, Vikas Mishra and Ashok Kumar Mishra, Inspector-in-Charge of West Bengal Police, were arrested on March 16, 2021, and April 13, 2021, respectively.

In this case, one prosecution complaint (charge sheet) was also filed on May 13, 2021, against both the accused.—ANS

Angel investor slams ex-Twitter India head of bullying at his startup

New Delhi, May 28 (ANS) As former Twitter India head Manish Maheshwari quit Invact Metaverse -- an online platform for education and Web3.0 and Metaverse -- in just six months of its birth, skeptics started tumbaling out after one of the angel investors accused Maheshwari of "lying and bullying".

Founded by Maheshwari and Tanay Pratap just six months ago, the startup in February received \$5 million in funding led by Arkam Ventures to build a massive education and expand globally.

In an email to investors, Gergely Orosz accused Maheshwari of wanting "more equity than vested". "Manish has been bullying Tanay into silence, threatening to use the company funds of \$1.7M, including our angel investment money, to sue him, should Tanay speak ill of him in public. This broke the straw with me, as that includes my money which I never invested in. The only way to do this is public: do it in public @manishm."

Maheshwari was yet to react to Orosz's allegations. On Friday, Maheshwari announced he is leaving the startup to "pursue new opportunities."

"I am moving out of Invact to first take a break for a few months and then pursue new opportunities. It is heartbreaking for a founder to leave the startup, like a mother leaving her baby. I am going through the same emotion," he tweeted.

Orosz alleged in the email that "Manish keeps walking back on promises he made to named investors, then breaking them."

"Named investors were meeting the terms he put up to accept the exit settlement so the company can continue to exist. He then walks back on these terms. He has been doing this for weeks. No current employees trust Manish to stay. They feel he has misled them too many times. I have talked with most of them to confirm this is the case," he claimed. Maheshwari earlier envisioned building a virtual-first curriculum and expanding into Europe and the US. "Metaverse is a concept that stands at a cusp where it will be a lead factor in transforming the educational landscape," said Maheshwari.

Business Brief

GIC Re logs PAT of Rs 2,005 cr, cuts underwriting loss

Chennai, May 28 (ANS) The General Insurance Corporation of India (GIC Re) closed last year with a higher after tax profit and gross premium income.

The company's Board of Directors has declared an interim dividend of Rs 2.25 per equity share (on face value of Rs 5 each) for the year under review.

During FY22, the GIC Re earned a gross premium income of Rs 43,208.46 crore as compared to Rs 47,014.38 crore for the year ended on March 31, 2021. Last fiscal the reinsurer had earned an after tax profit of Rs 2,005.74 crore as compared to Rs 1,920.44 crore logged in FY21. The company's investment income last year was Rs 9,562.29 crore up from Rs 8,820.86 crore earned the previous fiscal. The reinsurer's underwriting loss last year was at Rs 4,265.11 crore down from Rs 5,488.45 crore during FY21. The company's solvency ratio is 1.96 as on March 31, 2022 as compared to 1.74 as on March 31, 2021.

JK Tyre & Industries Q4 profit falls 80% to Rs 38 cr

New Delhi: JK Tyre & Industries reported 80 per cent decline in consolidated net profit at Rs 38.22 crore for the fourth quarter ended March 31, 2022, impacted by higher expenses primarily due to rise in input costs. The company had posted a net profit of Rs 194.96 crore for the same period of previous fiscal year, JK Tyre & Industries said in a regulatory filing.

Revenue from operations in the quarter stood at Rs 3,311.83 crore as against Rs 2,927.28 crore in the year ago period, it added.

Total expenses were higher at Rs 3,280.78 crore as compared to Rs 2,673.58 crore in the corresponding period a year ago, with cost of materials consumed rising to Rs 2,119.63 crore from Rs 1,839.44 crore in the same quarter previous year. For fiscal year ended March 31, 2022, consolidated net profit was at Rs 201.24 crore as compared to Rs 330.93 crore, down 39.2 per cent. Revenue from operations was at Rs 11,982.96 crore as compared to Rs 9,102.2 crore in FY21.

Cyber security, cyber resilience framework of boards, clearing corps, depositories: SEBI

New Delhi: Capital markets regulator Sebi said the cyber security and cyber resilience framework of stock exchanges and other market infrastructure institutions and mandated them to conduct a comprehensive cyber audit at least two times in a financial year. Along with the cyber audit reports, they have been directed to submit a declaration from the MD and CEO certifying compliance by the market infrastructure institutions (MIs) stock exchanges, clearing corporations and depositories with all SEBI guidelines and advisories related to cyber security issued from time to time, according to a circular.

While imposing the fine, the regulator said the behaviour of the Indigo ground staff and the handling of the child was "insufficient" and it "exacerbated the situation".

DGCA imposes Rs 5 lakh fine on Indigo for denying boarding to special child

New Delhi, May 28 (ANS) Civil aviation watchdog, the Directorate General of Civil Aviation (DGCA) on Saturday imposed a fine of Rs 5 lakh on low-cost carrier Indigo for denying boarding to a specially-abled child at Ranchi airport on May 7.

The Hyderabad-based flight left behind the child and their parents at the Ranchi airport.

Citing the event as "inappropriate handling" of a handicapped child, DGCA panel had decided to issue a show cause notice to the airline.

"A more compassionate handling would have smoothed nerves, and calmed the child. It would have obviated the need for the extreme step resulting in denied boarding to the passengers," it said in a note.

"Special situations deserve extraordinary response from airlines. In such an incident in the future, the regulator has decided to revisit its regulations and bring about the necessary changes in due course and also mandated a written consultation with the "Airport Doctor" on the state of health of the passenger and as well as the opinion of the commander of the aircraft in allowing passenger on board.



The Hyderabad-based flight left behind the child and their parents at the Ranchi airport.

CHANGE OF NAME

I have Changed My Old Name from **SHAH MANSHABAHEN HARESHKUMA** To New Name **SHAH MANSHABEN HARESHKUMA**.
Add: 8, Vrundavan Apartment, B/h. Hirabhai Tower, Maninagar, Ahmedabad-380008

CHANGE OF NAME

I have Changed My Old Name from **BHADRESHKUMAR SHANTILAL SHAH** To New Name **BHADRESHBHAI SHANTILAL SHAH**.
Add: 4, P.ushkar Apartment, Opp. Sopal Nagar, I, Jan Nagar, Ahmedabad, 380007

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

VARIOUS ELECTRICAL WORKS
E-Notice No. SE/DEE/AD/0922/201 dated 28-05-2022. No. 1, Tender No. EL-50-1-ADI-19-2022. No. 2, Tender No. EL-50-1-ADI-19-2022. Electrical work in connection with interlocking safety by rewiring of offices and station buildings. (2) Estimation No. E/1.36.10.080. (3) Earnest Money: Rs. 2,17,800. (4) Date and Time of Submission: 31.05.2022 at 11:00 hrs. (5) Name of the Engineer: Sd/- Divisional Electrical Engineer, D.R.M. Office, (W.R.) No. Charamda Bridge, G-5, Hospital, Naroda Road, Amdapatra, Ahmedabad-382 925-45. Web: www.treps.gov.in

CHANGE OF NAME

I have Changed My Old Name from **SOHIL DESAI** Working in **Kotak Mahindra Bank** and my ID Card No. **RA6565** has been misplaced and lost if any found please contact on **9924787818**

WESTERN RAILWAY - VADODARA DIVISION

APPOINTMENT AS "STATION TICKET BOOKING AGENT" (STBA)
Notification No. C 49/STBA/2022 Dtd. 23 May 2022
Sealed applications are invited for Appointment as "Station Ticket Booking Agent" (STBA) separately at following stations of Vadodara Division for issue of unreserved tickets through computerized Unreserved Ticketing System (UTS) at stations given below:

Sr No.	Station	STX	Sr No.	Station	STNA
1	Gothangam	GTN	11	Sadanapura	SNA
2	Panoli	PAO	12	Bhalaj	BAJ
3	Varenda	VRE	13	OD	OD
4	Lakodra	LKD	14	Kanji	KANJ
5	Kashipura Sarar	KSPR	15	Piloli	PILO
6	Varnama	VRM	16	Champamer	CPN
7	Ranoli	RNO	17	Bakrol	BKRL
8	Adas Road	ADR	18	Timba Road	TBR
9	Vidod	VLD	19	TWA	TWA
10	Utarsand	UTD	20	Naveli Khurd	NVK

Other details of the application: Contract period (per contract basis) : 03 (Three) year, Earnest Money: ₹ 2,00,00/- per application. Application document fee (non refundable): ₹ 1,000/- per application. Closing and Opening date & time of applications: 23-06-2022 at 15:00 hrs. 23-06-2022 at 15:30 hrs. (Address for detailed information: Sr. Divisional Commercial Manager's office, Western Railway, Pratsanagar, Vadodara. Website address: www.wr.indianrailways.gov.in)

AM INFRA DEVELOPERS

R.S.No.1208,Gatham road, Palanpur, Ta.palanpur, Di.Banskanth, Pin 385001, Gujarat.
NOTICE OF ENVIRONMENTAL CLEARANCE BY STATE LEVEL ENVIRONMENT IMPACT ASSESSMENT AUTHORITY (SEIAA) GUARANTY FOR DEVELOPMENT OF AKSHATAM SAPHTAM AT R.S. NO.1208, GATHAM ROAD, BANSKANTH.
Notice is hereby given to all concerned & public at large, that the Development of Akshatam Saphtam at Palanpur, has been Accorded Environment Clearance from SEIAA vide its letter (No.SEIAA/GU/EC/R/049/2022) of clearance dated 5th April 2022. The copy of the said clearance letter is available at the GPC&D and may also be seen at website of SEIAA/SEAC/GPC&D.

YURANUS INFRASTRUCTURE LIMITED

CIN: L74110GJ 1994PLC021352
Registered Office : 201, 2nd Floor, Maulik Arcade, Above Kamavai Park Aparthka Bazar, Mansi Cross Road, Vastapur, Ahmedabad - 380 015, Gujarat.
Phone: 07926733353 E-Mail: info@yuranusinfra.com

Extract of Audited Financial Results for the quarter ended 31st March 2022 (Rs. Lacs)

Sr No.	Particulars	Quarter ended 31-03-2022	Quarter ended 31-12-2021	Corresponding Quarter ended 31-03-2021	Year ended 31-12-2021
1	Total Income from Operations	18.03	9.88	3.70	51.78
2	Net Profit / (Loss) for the period before tax, Exceptional and/or Extraordinary (Items)	-1.14	2.84	-1.60	5.37
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-1.14	2.84	-1.60	5.37
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-1.05	2.20	-1.29	3.89
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-1.05	2.20	-1.29	3.89
6	Equity Share Capital	350.00	350.00	350.00	350.00
7	Other equity	0.00	0.00	0.00	0.00
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	-0.03	0.06	-0.04	0.11
	1. Basic (in Rs.)	-0.03	0.06	-0.04	0.11
	2. Diluted (in Rs.)	-0.03	0.06	-0.04	0.11

Note: Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Annual Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) & on Company's website (www.yuranusinfra.com)

Place : Ahmedabad. For: Yuranus Infrastructure Ltd. s.d/- Managing Director DIN: 0389420

INDO CREDIT CAPITAL LIMITED

Regd.Off.:304, Kaling, B/h. Bala Show Room, Nr. Mt. Carmel School, Ashram Road, Ahmedabad 380006
www.indocreditcapital.com email: indocredit@rediffmail.com Tele Fax: 079-26580366

Extract of Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2022 (Rs in Lakhs)

Particulars	Quarter ended 31/03/2022 (Audited)	Year ended 31/03/2021 (Audited)	Quarter ended 31/03/2021 (Audited)
Total Income from operations (net)	3.27	3.27	4.50
Net Profit / (Loss) for the period (Before Tax & exceptional Items)	2.59	-7.07	-1.83
Net Profit / (Loss) for the period before Tax (After Exceptional Items)	2.59	-7.07	-1.83
Net Profit / (Loss) for the period (After Tax & Exceptional Items)	2.59	-7.07	-1.83
Total Comprehensive Income for the period	2.59	-7.07	-1.83
Equity Share Capital	723.08	723.08	723.08
Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of previous year	-113.92	-113.92	-106.85
Earnings Per Share (of Rs.10/- each)			
Basic: (Rs.)	(-0.04)	(-0.10)	(-0.03)
Diluted: (Rs.)	(-0.04)	(-0.10)	(-0.03)

Note: 1. The aforesaid results of the Company were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 28th May, 2022.
2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results is available on the Stock Exchange websites: www.bseindia.com and on company's website www.indocreditcapital.com
3. Previous year's figures have been regrouped/rearranged wherever necessary.

Date : 28-05-2022 Place : Ahmedabad
For and on behalf of the Board of Directors
INDO CREDIT CAPITAL LIMITED
Ramkanan M. Saini
Director (DIN: 00439446)

CREATIVE CASTINGS LIMITED

CIN : L27100GJ 1985PLC 008286
Reg. Office: 102, GIDC Phase-II, Rajkot Road, Dolapara, Junagadh-03, Ph: +91 285 2660224. Fax: +91 285 2661348
Email: info@creative-cast.com, Web: www.creative-cast.com

Extract of Standalone Financial Results for the quarter and year ended on 31st March, 2022 (Rs.in lakhs)

Sl No.	Particulars	Standalone		Year to Date on	
		Quarter ended on 31/03/2022 (Audited)	31/12/2021 (Unaudited)	31/03/2022 (Audited)	31/03/2021 (Audited)
1	Total income from operations (net)	1,157.37	994.18	824.86	4,170.44
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	78.63	115.79	108.16	421.88
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	78.63	115.79	108.16	421.88
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	57.05	79.57	81.14	328.11
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	66.07	86.55	90.29	365.97
6	Equity Share Capital	130.00	130.00	130.00	130.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	2,976.71
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing operations) (Amount in Rs.)	4.39	6.12	6.24	25.24
	(a) Basic (in Rs.)	4.39	6.12	6.24	25.24
	(b) Diluted (in Rs.)	4.39	6.12	6.24	25.24

NOTES:
1. The above is an extract of the detailed format of Quarterly Audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same is available on the websites of the Stock Exchange i.e. www.bseindia.com and on the Company's website at www.creative-cast.com.
2. The financial results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards (Ind. AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended.

For & on behalf of the Board
CREATIVE CASTINGS LIMITED
Sd/-
Dhruvraj H. Dand
Chairman & Director
DIN: 00284065

PLACE : Dolapara, Junagadh DATED : 28.05.2022

PARAMOUNT COSMETICS (INDIA) LIMITED

Regd. office: Plot No. 165-B-1 & 16, 2nd Phase, G I D C, VAPI, Gujarat 386195
Corp. Off: 902-904,9th Floor, Prestige Meridian - 1, 29, M.G. Road, Bangalore - 560001
Ph No: 080-25207071; CIN No: L24240GJ 1985PLC 008282
Website: www.paramountcos.com Email: compliance.officer@paramountcos.com

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2022 (Rupees in Lakhs except EPS)

Sl.	Particulars	Quarter Ended		Year Ended	
		31-Mar-22 (Audited)	31-Dec-21 (Unaudited)	31-Mar-22 (Audited)	31-Mar-21 (Audited)
1	Total Income from Operations	564.31	1,890.20	696.26	2,474.51
2	Net Profit before Exceptional Items and Tax	(250.45)	283.91	134.85	34.77
3	Net Profit before Tax	(250.45)	283.91	134.85	33.47
4	Net Profit after Tax	(190.45)	210.02	108.97	19.58
5	Total Comprehensive Income for the Period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(182.87)	0	129.78	27.16
6	Equity Share Capital	485.50	485.50	485.50	485.50
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	0	0	0	0.31
8	Earning Per Share (Face Value Rs. 10 per share) (not annualised)				
a) Basic:	(3.92)	1.65	2.24	0.40	0.71
b) Diluted:	(3.92)	1.65	2.24	0.40	0.71

NOTES:
(1) The above is an extract of the detailed format of Audited Standalone Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Standalone Financial Results is available on the stock exchange website (www.bseindia.com) and Company's website (www.paramountcos.com)
(2) The above Results are reviewed by the Audit Committee and were approved and taken on record by the Board of Directors at its meeting held on 27.05.2022.

By Order of the Board of Directors
FOR, PARAMOUNT COSMETICS (INDIA) LIMITED
Sd/- Hitesh Topiwala
Managing Director (DIN 01603345)

Place : Bangalore Date : 27-05-2022

UJIVAN SMALL FINANCE BANK

Corporate Office: Grage Garden, 3rd Cross, 18th Main, 6th Block, Koramangala, Bengaluru 560095
Regional Office - West: Almondite IT Park, Sr.No.8, 7th Floor, Hattasapur Mundwa Byndras, Kharadi, Pune - 411014

POSITIVE IMPACT INVESTMENT
WHEREAS, The undersigned, being the Authorised Officer of Ujivan Small Finance Bank Ltd., under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 11.10.2021 calling upon the Borrower/Mortgagee to repay the amount of Rs.4,48,380.69 (Rupees Four Lakh Four Thousand Three Hundred Eighty & Sixty Nine paise only) as on 27.09.2021 within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 9 of the said Rules, on this the 23rd day of May of the year 2022.

The Borrower's and the public's attention is invited to provisions of sub-section (6) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Ujivan Small Finance Bank Ltd. for an amount of Rs.4,48,380.69 (Rupees Four Lakh Four Thousand Three Hundred Eighty & Sixty Nine paise only) as on 27.09.2021 and further interest and charges thereon.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All that piece and parcel of land measuring 26.76 sq.meters in the scheme known as "Sahya Gokul" situated at Moje Kalahada, Taluka Dasavoi, Dist. Ahmedabad at lastly registered as Survey No. 133 of the Ahmedabad Sub-Block No.395 (Old Survey No. 786/B) in registration Sub District and District of Ahmedabad-12 (W-9).

Place: Ahmedabad Authorised Officer
Date : 23.05.2022 Ujivan Small Finance Bank Ltd.

